

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર

જાહેરાત ક્રમાંક: ૧૫૧/૨૦૧૮૧૯

મંડળ દ્વારા પોલીસ મહાનિદેશકની કચેરી હસ્તકના બિન હથિયારી [પોલીસ સબ ઈન્સ્પેક્ટર] વર્ગ-૩ સંવર્ગની (મોડ-૨) ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૧૫૧/૨૦૧૮૧૯ ભાગ-૧ શારિરીક કસોટી ( Physical Test ) તા.૨૫/૧૧/૨૦૧૯ થી ૩૦/૧૧/૨૦૧૯ દરમિયાન શારિરીક શિક્ષણ અને રમત વિજ્ઞાન વિદ્યાશાખા સાદરા ખાતે હાથ ધરવામાં આવનાર છે.

ગૃહ વિભાગના તા.૧૪/૦૯/૨૦૦૪ના તેમજ તા.૧૦/૦૯/૨૦૧૪ના વખતો વખતના સુધારેલ વૈધાનિક ભરતી નિયમોમાં કરેલ જોગવાઈ મુજબ સદરહું શારિરીક કસોટીમાં ભાગ-૨માં ક્વોલીફાઈ થવા માટે વય મર્યાદા પ્રમાણે મહિલા અને પુરુષ ઉમેદવારોએ ૮૦૦ મીટર દોડની કસોટી નીચેની વિગતે નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહે છે.

**(ક) પુરુષ ઉમેદવારો માટે:**

ક્રમ	ઉંમર ગૃપ	મહત્તમ સમયમર્યાદા
૧	૩૫ વર્ષ સુધી	૫ મિનિટ અને ૧૦ સેકન્ડમાં
૨	૩૫ વર્ષથી વધુ ૪૦ વર્ષ સુધી	૫ મિનિટ અને ૨૫ સેકન્ડમાં
૩	૪૦ વર્ષથી વધુ ૪૫ વર્ષ સુધી	૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં
૪	૪૫ વર્ષથી વધુ ૫૦ વર્ષ સુધી	૬ મિનિટ અને ૧૦ સેકન્ડમાં
૫	૫૦ વર્ષથી વધુ ૫૫ થી વધુ વર્ષ	૬ મિનિટ અને ૪૫ સેકન્ડમાં

**(બ) સ્ત્રી ઉમેદવારો માટે:**

ક્રમ	ઉંમર ગૃપ	મહત્તમ સમયમર્યાદા
૧	૩૫ વર્ષ સુધી	૬ મિનિટ અને ૪૦ સેકન્ડમાં
૨	૩૫ વર્ષથી વધુ ૪૦ વર્ષ સુધી	૬ મિનિટ અને ૫૦ સેકન્ડમાં
૩	૪૦ વર્ષથી વધુ ૪૫ વર્ષ સુધી	૭ મિનિટ
૪	૪૫ વર્ષથી વધુ ૫૦ વર્ષ સુધી	૭ મિનિટ અને ૧૦ સેકન્ડમાં
૫	૫૦ વર્ષથી વધુ ૫૫ થી વધુ વર્ષ	૭ મિનિટ અને ૩૦ સેકન્ડમાં

ઉપરોક્ત શારિરીક કસોટીમાં ક્વોલીફાઈ થયેલ ઉમેદવારો ને ભાગ-૨ની લેખિત કસોટીમાં બોલાવવામાં આવશે.

❖ **લેખિત કસોટી:**

૧. લેખિત કસોટી નીચે મુજબના બે ભાગમાં રહેશે.  
ભાગ-૧ – ઓબ્જેક્ટીવ (હેતુલક્ષી) પ્રકારની લેખિત કસોટી  
ભાગ-૨ -- સબ્જેક્ટીવ (વર્ણનાત્મક) પ્રકારની લેખિત કસોટી
૨. જે ઉમેદવારોએ સફળતાપૂર્વક શારિરીક કસોટી ક્વોલીફાઈ થયેલ હશે તેમને મંડળ દ્વારા ઓબ્જેક્ટીવ (હેતુલક્ષી) પ્રકારની લેખિત કસોટી માટે બોલાવવામાં આવશે.
૩. ઓબ્જેક્ટીવ (હેતુલક્ષી) પ્રકારની લેખિત કસોટીમાં કેટેગરી વાઈઝ મેરીટના ધોરણે લાયકી ગુણ ધરાવતા ઉમેદવારોને સબ્જેક્ટીવ (વર્ણનાત્મક) પ્રકારની લેખિત કસોટી માટે બોલાવવામાં આવશે.
૪. સામાન્યતઃ ખાલી જગ્યાના પાંચ ગણા જેટલાં ઉમેદવારોને મંડળ દ્વારા સબ્જેક્ટીવ (વર્ણનાત્મક) પ્રકારની લેખિત કસોટી માટે બોલાવવામાં આવશે.
૫. ઓબ્જેક્ટીવ (હેતુલક્ષી) પ્રકારની લેખિત કસોટીનો અભ્યાસક્રમ નીચેના કોષ્ટક ( અનેક્ષર-એ ) માં દર્શાવ્યા મુજબનો રહેશે.

## એનેક્ષર-એ (ભાગ-૧)

ઓબ્જેક્ટીવ (હેતુલક્ષી) પ્રકારની લેખિત કસોટીના બે પ્રશ્નપત્રો અને ૨૦૦ ગુણ નીચે મુજબ રહેશે.

પ્રશ્નપત્ર	વિષય	ગુણ	સમય
૧	સામાન્ય અભ્યાસ અને માનસશાસ્ત્રીય કસોટી	૧૦૦	૧ કલાક ૩૦ મિનિટ
૨	કાનૂની બાબતો	૧૦૦	૧ કલાક ૩૦ મિનિટ
	કુલ ગુણ	૨૦૦	

૧. પરીક્ષા Multiple Choice Question (MCQ) અને Optical Mark Reading (OMR) પદ્ધતિની રહેશે.
૨. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે.
૩. ઉમેદવારે બધા પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
૪. ખોટાં જવાબદીઠ મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ કમી કરવામાં આવશે. નેગેટીવ માર્કીંગ લાગુ પડશે.
૫. દરેક પ્રશ્નોના જવાબોમાં એક વિકલ્પ 'E' "Not Attempted" રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ના માગતા હોય તો, આ વિકલ્પ પસંદ કરી શકશે. અને "Not Attempted" પસંદ કરવાના કિસ્સામાં નેગેટીવ માર્કીંગ લાગુ પડશે નહીં.
૬. પ્રશ્નના આપેલા બધા વિકલ્પમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ નહીં કરવામાં આવે તો મેળવેલ ગુણમાંથી ૦.૨૫ ગુણ કમી (નેગેટીવ માર્કીંગ) કરવામાં આવશે.

❖ પ્રશ્નપત્ર-૨ નો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.

No	Subject	Marks
1	Constitution of India. Part 3,4,5	05
2	Code of Criminal Procedure 1973	10
	Chapter: 2,4,5,7,8,9,10,11	
	Remaining Chapters	05
3	Indian Penal Code, 1860	10
4	Indian Evidence Act , 1872	10
5	Gujarat Police Act,1951	15
6	Gujrat Prohibition Act,1949	05
7	Prevention Of Corruption Act,1988	10
8	Schedule3d Castes and Scheduled Tribes (prevention of Atrocities ) Act, 1989	10
9	Motor Vehicles Act, 1988	05
10	Gujarat Prevention of Gambling Act, 1887	05
11	Questions on Police Function related to investigation, crime control, law and order and working of a police station.	10

## એનેક્ષર -બી (ભાગ-૨)

(૧) સબ્જેક્ટીવ (વર્ણાત્મક) પ્રકારની લેખિત પરીક્ષા નીચે મુજબ, ૨૦૦ ગુણની ૨(બે) પ્રશ્નપત્રોની રહેશે.

પ્રશ્નપત્ર	વિષય અને સમાવિષ્ટ બાબતો	ગુણ	સમયમર્યાદા
૧	ગુજરાતી ભાષા,( વર્ણનાત્મક), ગુજરાતી વ્યાકરણ, વર્બલ એપ્ટીટ્યુડ વોકેબ્યુલરી, ઇડીયમ્સ , કોમ્પ્રીહેંશન.	૧૦૦	૩ કલાક
૨	અંગ્રેજી ભાષા,( વર્ણનાત્મક), અંગ્રેજી વ્યાકરણ, વર્બલ એપ્ટીટ્યુડ વોકેબ્યુલરી, ઇડીયમ્સ , કોમ્પ્રીહેંશન.	૧૦૦	૩ કલાક

ઉક્ત સંવર્ગની શારિરીક કસોટી ( Physical Test ) માટેની સૂચનાઓ અને સમય તથા કોલેલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગત વાર કાર્યક્રમ મંડળની વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેની સંબંધીત દરેક ઉમેદવારે જરૂરી નોંધ લેવા આથી જણાવવામાં આવે છે.

તા.૧૯/૧૧/૨૦૧૯

સ્થળ: ગાંધીનગર

સચિવ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ,

ગાંધીનગર